

:- સુચનાઓ અને શરતો :-

- (૧) અરજી પત્ર સાથે અરજદારે રહેઠાણના પુરાવા માટે (લાઈટ બીલ/વેરા પાવતી/રેશનકાર્ડ/આધારકાર્ડ) અને ઉંમરના પુરાવા માટે (શાળા છોડયાનો દાખલો/ડોક્ટરનું પ્રમાણ પત્ર /સોગંદનામુ / જન્મ નોંધણીનુ પ્રમાણપત્ર ) તથા પોતાની ઓળખ માટે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તથા નોકરીદાતા તરફથી મળેલ ઓળખકાર્ડની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે.
- (૨) આ અરજી ફોર્મ જે વ્યક્તિને આપવામાં આવેલ છે, તે વ્યક્તિએ જ તેનો ઉપયોગ કરવાનો રહેશે.
- (૩) આ યોજનાનો લાભ ફક્ત સફાઈ કામદારો અને તેના આશ્રિતોને જે આપવામાં આવશે. તે માટે સક્ષમ અધિકારીનો દાખલો અરજી સાથે નિયત સત્તાધિકારી પાસેથી મેળવીને રજૂ કરવાનો રહેશે.
- (૪) અરજદારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- (૫) અરજદારે વાહન મેળવવા અરજી કરી હોય તો વાહન ચલાવવાનું અંગેનું આર.ટી.આઈ. નું ચાલુ પાકું લાયસન્સ તથા ચાલુ બેઈઝ રજૂ કરવાના રહેશે.
- (૬) અરજદારે અન્ય ધંધા/વ્યવસાય (વાહન સિવાય) માટે અરજી કરેલ હોય તો તે અંગે જરૂરી શૈક્ષણિક લાયકાત, તાલીમ અને અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિક નકલો રજૂ કરવાની રહેશે.
- (૭) અરજદારની લોન/ધિરાણ મળ્યેથી વાહન/સાધનો નિગમની તરફેણમાં હાઈપોથીકેશન કરી આપવાના રહેશે તથા નિગમ તરફથી નક્કી કર્યા પ્રમાણે બાહેધરી/જામીન ખત /સાનગીરો વગેરે દસ્તાવેજો અરજદારે સ્વખર્ચે કરી આપવાના રહેશે.
- (૮) વાહન/સાધનોને આગ, અક્સ્માત, ચોરી, હુલ્લડ અને આફતો/આતંક/ભૂકંપ વગેરે સામે રક્ષણ મળે તે માટે વિમા કંપની પાસેથી લોનની રકમ જેટલો વાહનના/દુકાન/માલસામાન અને સાધન-સામગ્રીનો/ડેરી યુનિટ પરત્વે વિમો લેવાનો રહેશે તથા તેનું દર વર્ષે નિયમિત રીતે વિમા પ્રિમીયમ ભરી તેની પહોંચ જિલ્લા કચેરીમાં જમા કરાવવાની રહેશે.
- (૯) જ્યાં સુધી લોનની રકમ વ્યાજ સહિત પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યા સુધી અરજદાર વાહન/સાધનો અન્વયે વેચી શકશે નહિ કે ગિરો મુકશે નહિ કે ભાડે થી કે પેટાભાડે થી અથવા અન્ય કોઈ પણ પ્રકારે તબદિલ કરી શકશે નહિ.
- (૧૦) નિગમ તરફથી ધિરાણ કરવામાં આવેલ રકમ ઉપર નિયત દર અથવા વખતો વખત થનાર સુધારા વધારા મુજબનું વ્યાજ લેવામાં આવશે તથા નિગમ નક્કી કરે તે પ્રમાણે લોન હતા દર માસે નિગમે નક્કી કરેલ બેંકની નજીકની શાખામાં પે-ઈન-સ્વીપ થી ભરવાની રહેશે. સમયસર હતા ભરવામાં નહિ આવે તો નિગમ નક્કી કરે તે મુજબ દંડનિય વ્યાજ લેવામાં આવશે.
- (૧૧) યડત રકમના હતા ભરવામાં ચૂક થયેથી એડવાન્સ જમા કરાવેલ ચેક પરત થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. આવા સંજોગોમાં બાકીદાર તરીકે કોર્ટ રાહે તમામ રકમ વસુલ કરવા કાર્યવાહી કરવામાં આવશે.
- (૧૨) લોન પરત ભરપાઈ કરવા માટે અંગત જામીનગીરી ખત આપવાનો રહેશે.
- (૧૩) બાકીદાર તરીકેની નોંધના કારણે અન્ય યોજનાઓના લાભોથી વંચિત રહેવું પડે તો તેની જવાબદારી લાભાર્થીની છે.
- (૧૪) કોઈપણ સરકારી/અર્ધ સરકારી/એજન્સી/નિગમ કે સંસ્થા પાસેથી અગાઉ લીધેલ ધિરાણ/સહાયની વિગત આપવાની રહેશે.
- (૧૫) અરજદારે રૂ ૧.૦૦ લાખ સુધીના ધિરાણ માટે એક જામીન તેમજ પાંચ પોસ્ટ ડેટેડ ચેક અને રૂ ૧.૦૦ લાખ થી વધુ ધિરાણ માટે બે જામીન અને દશ પોસ્ટ ડેટેડ ચેક ધિરાણ માટે પસંદગી થયેથી રજૂ કરવાના રહેશે. આવા જામીન સરકારી કર્મચારી હોય તેવા/જામીન-મિલ્કત ધરાવતો હોય તેવા આપવાના રહેશે.
- (૧૬) અરજદારે જે સ્થળે ધંધો/વ્યવસાય કરવા માગતા હોય તે સ્થળનું નામ, સરનામુ, ક્ષેત્રફળ દર્શાવતો કાચો નકશો મકાન, દુકાન, ભાડાનું હોય તો ભાડા કરાર, માલિક નું સંમતિ પત્ર, સ્થળના પુરાવા, આવક-જાવકના સંભવિત અંદાજો તથા પ્રોજેક્ટની વિગતો રજૂ કરવાની રહેશે.
- (૧૭) ધંધા/વ્યવસાય તથા વાહનની લોનના કિસ્સામાં એજન્સી પાસેથી કોટેશન મેળવી રજૂ કરવાના રહેશે.

ઉપરના નિયમો અને શરતો મે ધ્યાન પૂર્વક વાંચ્યા છે અને તે મને તેમજ મારા વંશ વાલી-વારસોને કબુલ મંજૂર છે, તેવી કબૂલાત અને ખાતરી આપું છું.

સાક્ષીની સહી : .....

અરજદારની સહી: .....

સાક્ષીનું નામ : .....

તારીખ: .....